


પ્રશ્ન 1 : નીચેનામાં એકરૂપતાની કઈ શરતનો ઉપયોગ કરશો ?

(a) પદ્ધતિ : $AC = DF, AB = DE, BC = EF$. આથી $\Delta ABC \cong \Delta DEF$.




ઉકેલ : અહીં ત્રિકોણની ગણેય બાજુઓના માપ સમાન છે તેમ આપેલું છે.

તેથી, બાબાબા શરત મુજબ,

$$\Delta ABC \cong \Delta DEF$$

(b) પદ્ધતિ : $ZX = RP$, $RQ = ZY$, $\angle PRQ = \angle XZY$. આથી $\triangle PQR \cong \triangle XYZ$.




ઉકેલ : અહીં ત્રિકોણની બે બાજુઓના માપ $ZX = RP$ અને $RQ = ZY$ સમાન છે તેમજ આ બન્ને બાજુઓ વડે બનતો ખૂણાં કો $\angle PRQ = \angle XZY$ આપેલું છે.

તેથી, બાખૂબા શરત મુજબ,

$$\triangle PQR \cong \triangle XYZ$$


(c) पक्ष : $\angle MLN = \angle FGH$, $\angle NML = \angle GFH$, $ML = FG$. आणि $\triangle LMN \cong \triangle GFH$.



उकेल : अहीं त्रिकोणाना बे खूणाओना माप $\angle MLN = \angle FGH$ अने $\angle NML = \angle GFH$ समान छे तेमज आ
बन्ने खूणाओनी अंतर्गत बाजु $ML = FG$ आपेलुं छे.
तेथी, खूबाखू शरत मुजब,

$$\triangle LMN \cong \triangle GFH$$

(d) पक्ष : $EB = DB$, $AE = BC$, $\angle A = \angle C = 90^\circ$. आर्थी $\triangle ABE \cong \triangle CDB$.




उक्ते : अहीं त्रिकोणाना कर्ण नुँ माप $EB = DB$ अने एक बाजु $AE = BC$ समान छे तेमज आ काटभूणो $\angle A = \angle C = 90^\circ$ आपेलुं छे.

तेथी, काकबा शरत मुजब,

$$\triangle ABE \cong \triangle CDB$$

પ્રશ્ન 2 : તમારે સાબિત કરવું છે કે $\triangle ART \cong \triangle PEN$,


- (a) જો તમારે બાબાબા શરતનો ઉપયોગ કરવો હોય, તો તમારે
(i) $AR = ?$, (ii) $RT = ?$, (iii) $AT = ?$ બતાવવું પડે ?



ઉકેલ : બાબાબા શરત મુજબ નીચે મુજબ બતાવવું પડે.

- (i) $AR = PE$, (ii) $RT = EN$, (iii) $AT = PN$

(b) જો $\angle T = \angle N$ આપેલ હોય, અને બાખૂબા શરતનો ઉપયોગ કરવો હોય, તો
(i) $RT = ?$, અને (ii) $PN = ?$ હોવું જોઈએ.




ઉકેલ : બાખૂબા શરત મુજબ નીચે મુજબ બતાવવું પડે.

(i) $RT = EN$, (ii) $PN = AT$

(c) જો $AT = PN$ આપેલ હોય, અને તમારે ખૂબાખૂ શરતનો ઉપયોગ કરવો હોય, તો ક્યા બે પરિણામો હોવાં જોઈએ ?


(i) ? અને (ii) ?



ઉકેલ : ખૂબાખૂ શરત મુજબ નીચે મુજબ બતાવવું પડે.

(i) $\angle RAT = \angle EPN$, (ii) $\angle RTA = \angle ENP$

પ્રશ્ન 3 : તમારે $\DeltaAMP \cong \DeltaAMQ$, સાબિત કરવાનું છે નીચેની સાબિતીમાં ખૂટતાં કારણો આપો :



ઉકેલ :


પગલું	કારણ
(i) $PM = QM$	આપેલું છે.
(ii) $\angle PMA = \angle QMA$	આપેલું છે.
(iii) $AM = AM$	સામાન્ય બાજુ
(iv) $\DeltaAMP \cong \DeltaAMQ$	બાખૂબા શરત

પ્રશ્ન 4 : $\triangle ABC$ માં $\angle A = 30^\circ$, $\angle B = 40^\circ$ અને $\angle C = 110^\circ$ તેમજ $\triangle PQR$ માં $\angle P = 30^\circ$, $\angle Q = 40^\circ$ અને $\angle R = 110^\circ$ છે. એક વિદ્યાર્થી કહે છે કે ખૂખૂખૂ શરત પ્રમાણે $\triangle ABC \cong \triangle PQR$ છે. શું એ સાચો છે ? શા માટે ? શા માટે નહિં ?

ઉકેલ : ના તે વિદ્યાર્થી સાચો નથી.

કારણ કે આવા પ્રકારના ત્રિકોણ માટે એક ત્રિકોણ બીજા ત્રિકોણની મોટી કરેલી (Enlarged) નકલ હોઈ શકે છે.

પ્રશ્ન 5 : આપેલી આકૃતિમાં બે ત્રિકોણ એકરૂપ છે. અનુરૂપ અંગો નિશાનીથી દર્શાવેલા છે. $\triangle RAT \cong \underline{\hspace{2cm}}$ લખી શકાય ?



ઉકેલ : આકૃતિ પરથી આપેલા ત્રિકોણ માટે સંગતતા $R \leftrightarrow W$, $A \leftrightarrow O$ તેમજ $T \leftrightarrow N$ મળશે.

તેથી, અહીં બાખૂબા શરત મુજબ $RA = WO$ તેમજ $AT = ON$, અને તેમનો અંતર્ગત ખૂણો $\angle A = \angle O$, મળે તેથી, $\triangle RAT \cong \triangle WON$ એકરૂપતા મળે.